

ક્રમાંક: કેકાસવાકો/મકમ/૨૦૨૩-૨૪/૭૫૫
 શ્રી કે.કા.શાસી સરકારી કોમર્સ કોલેજ
 ખોખરા રોડ, મહિનગર(પૂર્વ),
 અમદાવાદ-૩૮૦૦૦૮.
 તા. ૨૩/૦૬/૨૦૨૩

વંચાણે લીધા :- (૧) ગુજરાત સરકારશીના સામાન્ય વહીવટના તા. ૦૪/૦૩/૧૪ ના સરકારી
 ઠરાવ નં. ખહલ/૧૦૨૦૧૩-૫૬૨૨૬૪/ક અનુસાર કાર્યયોજના

:: ક ચે રી આ દે શ ::

શ્રી કે.કા.શાસી સરકારી કોમર્સ કોલેજ, અમદાવાદમાં વાણિજ્ય વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. પ્રતિવર્ષ બહોળી સંખ્યામાં વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. આ વિદ્યાર્થીઓના પ્રવેશ, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય, આંતરિક પરીક્ષા અને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની કામગીરી તથા સહશૈક્ષણિક કામગીરી સુચારુ રીતે થાય તે માટે કોલેજ કક્ષાએ નીચે મુજબની કાર્યયોજના પ્રમાણે સમિતીની રચના સિનિયોરિટીના બાધ વિના સરખા ભાગે કામગીરી વહેંચણીના આશયથી વહીવટી સરળતા ખાતર કરવામાં આવેલ છે તેમજ વખતોવખત આચાર્યશ્રી તરફથી સૌંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે. સંબંધિતોએ નીચે દર્શાવેલ કામગીરી અંગેનો અન્ય બીજો આદેશ ન થાય ત્યાં સુધી કરવાની રહેશે.

Name of the Committee		Nature of Work (Work Plan)
1 Student Representative Committee (SRC)		
1	Shri I. M. Rathod (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજ વિદ્યાર્થી પ્રતિનિધિ સભાની રચના ગુજરાત યુનિવર્સિટીના નિયમો અનુસાર મેરીટ પ્રમાણે કરવી.
2	Shri S. D. Maheria	
3	Shri S. A. Khaneja	<ul style="list-style-type: none"> ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સ્ટુડન્ટ વેલ્ફેર સમિતીના મતદાતાઓના નામ નિયમાનુસાર પસંદ કરી યુનિવર્સિટીને સમયમર્યાદામાં મોકલવાની કામગીરી રાષ્ટ્રીય પવોની ઉજવણીના આયોજન અને અમલીકરણ કોલેજનો વાર્ષિક ઇનામ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં હિસ્સેદારી (તમામ સમિતિના સંકલનમાં રહીને)

2 Examination Committee	
1	Dr. M. B. Mansuri (Over all Examination Coordinator)
2	Shri I. M. Rathod (F.Y. B Com Co-Coordinator)
3	Dr. B. N. Solanki (S.Y. B Com Co-Coordinator)
4	Dr. P. Singh (T.Y. B.Com Co-Coordinator)
5	Shri S. D. Maheria (M.Com Coordinator)
6	Shri S. P. Parmar
7	Shri V. S. Pandor

- કોલેજની તમામ પરીક્ષાના આયોજન અને અમલીકરણ
- ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના આંતરિક ગુણાંકન મોકલવાની કામગીરી તથા તેને આનુષાંગિક કામગીરી
- વિદ્યાર્થીઓના કોલેજના પરિણામ અને યુનિવર્સિટી પરીણામના રેકર્ડની જાળવણી
- ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના ઝોર્ઝ ભરાવવાની અને મોકલવાની કામગીરી
- ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું આયોજન કરવું.

3	Purchasing Committee	
1	Shri S. A. Khaneja	<ul style="list-style-type: none"> કોલેજની વિવિધ જરૂરીયાતો માટે નિયમાનુસાર ખરીદ પ્રક્રિયાની કામગીરી કરવી
2	All faculty and office staff / Respective Committee members	<ul style="list-style-type: none"> UGC અને RUSAની નિયમાનુસાર ખરીદ પ્રક્રિયા કામગીરી કરવી.

4	Internal Quality Assurance Cell (IQAC)	
1	Shri V. P. Gallani (Coordinator)	<ul style="list-style-type: none"> NAACની માર્ગદર્શિકા અનુસાર રિપોર્ટ તૈયાર કરવો તથા ડોક્યુમેન્ટેશન કરવું.
2	Shri I. M. Rathod	
3	Dr. V. H. Raval	
4	Dr. M. J. Mansuri	<ul style="list-style-type: none"> IQACને લગતી તમામ કામગીરી કરવી.
5	Shri S. D. Maheria	
6	Dr. T. P. Gandhi	

5	IT and Website Maintenance Committee	
1	Dr. T. P. Gandhi (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજના કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ તથા વાઈ-ફાઈના જળવણી અને મરામત અંગેની કામગીરી
2	Dr. M. J. Mansuri	
3	Shri S. A. Khaneja	
4	Shri V. S. Pandor	<ul style="list-style-type: none"> કોલેજની વેબસાઇટની જળવણી અને અપડેશનની કામગીરી આના સાધનોનું મેળવણું યોગ્ય સમયાંતરે થાય તે અંગેની કામગીરી કરવી.

6	UGC & Research Committee	
1	Dr. P. P. Sharma (Coordinator)	<ul style="list-style-type: none"> UGC/Central Government/ State Government / International Organization and other research institutes etc. ની વિવિધ સ્કીમો માટેની માહીતી મેળવવી અને તે મુજબ રીસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરાવવાની અને અંગેની અન્ય આનુસંદિક કામગીરી, રીસર્ચને પ્રોત્સાહન મળે તે અંગેના કાર્યક્રમોનું આયોજન
2	Dr. Palak Shah	
3	Dr. P. Singh	

7	UDISHA – Career and Counseling Cell	
1	Dr. B. N. Solanki (Coordinator)	<ul style="list-style-type: none"> વિદ્યાર્થીઓની રોજગારક્ષમતા વધે તે માટેની તાલીમ અને વિવિધ કાર્યક્રમો કરવા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનના કાર્યક્રમો આયોજીત કરવા
2	Shri N. J. Shah (Co- Coordinator)	
3	Shri S. P. Raval	<ul style="list-style-type: none"> વિવિધ કંપનીઓ સાથે વાર્તાલાપ સાધી વિદ્યાર્થીઓને રોજગાર મળે તે માટેના કાર્ય, કે.સી.જી. કોરેચી છારા આયોજીત કાર્યક્રમો માટેની કામગીરી કરવી

8	Time Table and Academic Planning Committee, Foundation Soft Skill Subject Lecture Arrangement and Teaching Work Report	
1	Dr. M. J. Mansuri (Coordinator)	<ul style="list-style-type: none"> યુનિવર્સિટીના નિયમોનુસાર અને એકેડેમિક કોલેજના સમયપત્રકની રચના,
2	Shri M. B. Maradiya	<ul style="list-style-type: none"> કોલેજની એકેડેમિક અને અન્ય કાર્યક્રમોની માહિતી તૈયાર કરવી અને આ કાર્યક્રમો માટે વર્ગાંડોની વૈકલ્પિક વ્યવસ્થા કરવી
3	Shri S. A. Khaneja	<ul style="list-style-type: none"> કોલેજના નોટીસબોર્ડની સુચનાઓની કામગીરી અને તેના રેકર્ડની જાળવણી ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ અનુસાર ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કીલના વિષયો માટે તમામ સેમેસ્ટરના વર્ગો આયોજિત કરવા તે માટે મુલાકાતી તજજોની વ્યવસ્થા કરવી. તેમના કાર્યનું દેખરેખ રાખી વ્યાપ્યાન દીઠ મહેનતાણાની ચુકવણી પ્રક્રિયા હાથ ધરવી. જેતે વિષયમાં વર્કલોડ અનુસાર અધ્યાપકની ઘટ હોય તે માટે નિયમાનુસાર મુલાકાતી તજજોની વ્યવસ્થા કરવી. તેમના કાર્યનું દેખરેખ રાખી વ્યાપ્યાન દીઠ મહેનતાણાની ચુકવણી પ્રક્રિયા હાથ ધરવી.

9	Cultural, Youth Festival and Saptdhara Committee	
1	Dr. V. H. Raval (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સપ્તધારાની કમિટીના માધ્યમથી આયોજન કરવું.
2	Shri I. M. Rathod	<ul style="list-style-type: none"> કોલેજનો વાર્ષિકોત્સવનું આયોજન કરવું
3	Shri S. D. Maheria	<ul style="list-style-type: none"> સપ્તધારાની કમિટીએ કેસીજી દ્વારા સુચિત કાર્યક્રમોનું આયોજન કરવું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સપ્તધારાના કાર્યક્રમોનો, કોલેજનો વાર્ષિકોત્સવનો અને અન્ય ધારા હેઠળ થયેલ પ્રવૃત્તિઓનો અહેવાલ તમામ ધારાની સમિતિના સભ્યો સાથે રહીને તૈયાર કરીને કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી

10	Sarjanatmak Abhivakti Dhara and Swami Vivekanand Value Education Center	
1	Dr. Palak Shah (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાંસ્કૃતિક કભિટીના કન્વીનરશીપ હેઠળ આયોજન કરવું કોલેજનો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં કામગીરી કરવી કેસીજી દ્વારા સૂચિત કાર્યક્રમોનું આયોજન કરવું સેમિનાર, વિવિધ સ્પર્ધાઓ અને વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવું અને આયોજિત થયેલ તમામ કાર્યક્રમોનો અહેવાલ સમયાંતરે ૨જી કરવો. કાર્યક્રમોનો અહેવાલ તૈયાર કરી કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી
2	Dr. M. J. Mansuri	
3	Dr. T. P. Gandhi	

11	Rang Kala Kaushalya Dhara	
1	Dr. Palak Shah (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાંસ્કૃતિક કભિટીના કન્વીનરશીપ હેઠળ આયોજન કરવું કોલેજનો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં કામગીરી કરવી કેસીજી દ્વારા સૂચિત કાર્યક્રમોનું આયોજન કરવું કાર્યક્રમોનો અહેવાલ તૈયાર કરી કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી
2	Dr. P. Singh	
3	Dr. P. P. Sharma	

12	Library Committee and Gyan Dhara	
1	Dr. M. J. Mansuri (Coordinator)	<ul style="list-style-type: none"> ગ્રંથાલયના પુસ્તકોનો વિદ્યાર્થી ઉપયોગ કરી શકે તે મુજબની કાર્યવાહી કરવી. પુસ્તકોનું મેળવણું ચોગ્ય સમયાંતરે થાય તે અંગેની કામગીરી કરવી. ખરીદ સમિતિના સંકલનમાં રહીને પુસ્તકોની નિયમોનુસાર ખરીદ પ્રક્રિયાથી ખરીદી કરવી. કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાંસ્કૃતિક કભિટીના કન્વીનરશીપ હેઠળ આયોજન કરવું કોલેજનો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં કામગીરી કરવી અને કેસીજી દ્વારા સૂચિત કાર્યક્રમોનું આયોજન કરવું કોલેજના લીંતપત્રની કામગીરી કરવી કાર્યક્રમોનો અહેવાલ તૈયાર કરી કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી
2	Dr. P. Singh	
3	Shri V. P. Gallani	

13	Geet Sangeet Nrutya Dhara	
1	Dr. P. Singh (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાંસ્કૃતિક કમિટીના કન્વીનરશીપ હેઠળ આયોજન કરવું, કોલેજનો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં કામગીરી કરવી
2	Dr. T. P. Gandhi	<ul style="list-style-type: none"> કેસીજી દ્વારા સૂચિત કાર્યક્રમોનું આયોજન કરવું
3	Shri M. B. Maradiya	<ul style="list-style-type: none"> કાર્યક્રમોનો અહેવાલ તૈયાર કરી કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી

14	Natya Dhara	
1	Dr B. N. Solanki (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાંસ્કૃતિક કમિટીના કન્વીનરશીપ હેઠળ આયોજન કરવું
2	Dr. P.P. Sharma	<ul style="list-style-type: none"> કોલેજનો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં કામગીરી કરવી
3	Shri N. J. Shah	<ul style="list-style-type: none"> કેસીજી દ્વારા સૂચિત કાર્યક્રમોનું આયોજન કરવું કાર્યક્રમોનો અહેવાલ તૈયાર કરી કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી

15	NSS Unit, Samudaiyak Seva Dhara, Azadi ka Amrut Mahotsav ke Panch Prakalp,	
1	Dr. V. B. Manek (Coordinator)	<ul style="list-style-type: none"> NSSની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું
2	Shri S. D. Maheriya	<ul style="list-style-type: none"> NSS અનુદાનો વપરાશ અંગેનો ઓડિટ કરાવીને યુનિવર્સિટી ખાતે જમા કરાવવો.
3	Dr. V. H. Raval	<ul style="list-style-type: none"> કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાંસ્કૃતિક કમિટીના કન્વીનરશીપ હેઠળ આયોજન કરવું
4	Shri N. J. Shah	<ul style="list-style-type: none"> કોલેજનો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં કામગીરી કરવી
5	Shri M. B. Maradiya	<ul style="list-style-type: none"> કેસીજી દ્વારા સૂચિત કાર્યક્રમોનું આયોજન કરવું
6	Shri S. P. Raval	<ul style="list-style-type: none"> કોલેજના ભીતપત્રની કામગીરી કરવી કાર્યક્રમોનો અહેવાલ તૈયાર કરી કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી

16	Gymkhana Committee and Khelkud, Vyayam, YogDhara	
1	Shri I. M. Rathod (Coordinator)	<ul style="list-style-type: none"> રમતગમત ક્ષેત્રે કોલેજની ટીમની પસંદગી તેઓને માર્ગદર્શન તથા યુનિવર્સિટી અને અન્ય કક્ષાએ આયોજીત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને ભાગ લે તે માટેની યોગ્ય વ્યવસ્થા
2	Dr. Alpaben Amin	<ul style="list-style-type: none"> કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક કમિટીના કન્વીનરશીપ હેઠળ આયોજન કરવું કોલેજનો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં કામગીરી કરવી કેસીજી દ્વારા સૂચિત કાર્યક્રમનું આયોજન કરવું કોલેજના ભીતપત્રની કામગીરી કરવી કાર્યક્રમોનો અહેવાલ તૈયાર કરી કોલેજની વેબસાઇટ પર અને સરકારશીમાં, યુનિવર્સિટી તથા કેસીજી માં મોકલવાની કામગીરી
3	Shri V. P. Gallani	

17	Reports, Magazine & Newsletter committee	
1	Dr. T. P. Gandhi (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં થતી તમામ પ્રવૃત્તિ અને કાર્યક્રમોના રિપોર્ટ સંબંધિત સમિતિ પાસેથી મેળવીને વાર્ષિક અહેવાલ તૈયાર કરવો તેમજ તેની પ્રિન્ટ કરવી.
2	All Teaching Staff	
3	All Non-Teaching Staff	<ul style="list-style-type: none"> સંબંધિત સમિતિ પાસેથી સમયસર કામગીરીનો અહેવાલ મેળવીને વેબસાઇટ પર અપલોડ કરવા.

18	CWDC and Gender Sensitization Committee	
1	Dr. Palak Shah (Coordinator)	<ul style="list-style-type: none"> CWDC અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવું
2	Shri M. B. Maradiya	
3	Shri I. M. Rathod	
4	Shri S. A. Khaneja	<ul style="list-style-type: none"> Gender Sensitization Committeeને લગતી કામગીરી કરવી
5	Shri S.P. Raval	

19	Anti Ragging Committee	
1	Shri I. M. Rathod (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું
2	Shri S. D. Maheriya	
3	Shri S. A. Khaneja	

20	AISHE Committee, NIRF and GSIRF and Digi Locker & ABC & Data Management Committee	
1	Dr. P. P. Sharma (Coordinator)	<ul style="list-style-type: none"> AISHE અંગેની કામગીરી સમયમર્યાદામાં કરવી
2	Dr. T. P. Gandhi	
3	Shri S. D. Maheria	
4	Shri S. P. Raval	<ul style="list-style-type: none"> કોલેજનો તમામ ડેટાબેઝ સોફ્ટ અને હાર્ડકોપીમાં અધ્યતન રાખવો.
5	Shri V. S. Pandor	

21	Discipline Committee	
1	Shri I. M. Rathod (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજના વિદ્યાર્થીઓમાં શિસ્ત જગવાય તે અંગેની કામગીરી પરસ્પર સહકારથી સંયુક્તપણે કરવી.
2	All Teaching & Non-Teaching Staff	

22	RUSA Committee and Ek Bharat Shreshta Bharat Committee	
1	Shri S. D. Maheria (RUSA Coordinator)	<ul style="list-style-type: none"> RUSA અંતર્ગત વિવિધ દરમાસ્તો તૈયાર કરી અનુદાન મેળવવાની અને વપરાશની કામગીરી કરવી
2	Shri I. M. Rathod	
3	Shri S. A. Khaneja	
4	Shri S.P.Parmar	

23	SCOPE & DELL LAB	
1	Dr. P. Singh (Coordinator)	<ul style="list-style-type: none"> સ્કોપ અને ડેલલેબને લગતી તમામ કામગીરી કરવી.
2	Dr. T. P. Gandhi	
3	Shri S. A. Khaneja	
4	Shri S. P. Raval	

24	Anti-Sexual Harassment Of Women Cell	
1	Shri M. B. Maradiya (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી.
2	Shri S.P.Parmar	

25	Students Guidance Committee& Grievance Redressal Committee	
1	Dr. M. B. Mansuri (Over all Coordinator)	<ul style="list-style-type: none"> વિદ્યાર્થીઓના માર્ગદર્શનની કામગીરી કરવી
2	Shri I. M. Rathod (F.Y. B Com Co-Coordinator)	<ul style="list-style-type: none"> Transcript ચકાસણીની કામગીરી કરવી
3	Dr. B. N. Solanki (S.Y. B Com Co-Coordinator)	<ul style="list-style-type: none"> બસના પાસમાં સહી અંગેની કામગીરી કરવી
4	Dr. P. Singh (T.Y. B. Com Co-Coordinator)	
5	Shri S. D. Maheria (M.Com Co ordination)	

26	SC/ST/Minority cell and MYSY & National Scholarship Portal	
1	Dr. B.N. Solanki (Coordinator)	<ul style="list-style-type: none"> કોલેજમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી.
2	Shri I. M. Rathod	
3	Shri S. D. Maheria	
4	Shri S. P. Parmar	
5	Shri V. S. Pandor	<ul style="list-style-type: none"> MYSY & National Scholarship Portalને લગતી નિયમાનુસારની સમયાંતરે કામગીરી કરવી.

27	Eco Club	
1	Dr. Palak Shah (Coordinator)	<ul style="list-style-type: none"> નિયમોનુસાર સમયાંતરે ઇકો કલબની કામગીરી કરવી
2	Dr. V. B. Manek	<ul style="list-style-type: none"> ઇકો કલબને લગતા સેમિનાર, વિવિધ સ્પર્ધાઓ અને વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવું.
3	Shri S.P.Raval	<ul style="list-style-type: none"> ઇકો કલબને લગતા આયોજિત થયેલ તમામ કાર્યક્રમોનો અહેવાલ સમયાંતરે રજૂ કરવો

28	Finishing School	
1	Dr. P. Singh (Coordinator)	• કેસીજીના નિયમોનુસાર સમતાંતરે ફિનિશિંગ સ્કુલની કામગીરી કરવી.
2	Dr. Palak Shah	
3	Shri S.P.Raval	

29	SSIP & Innovation Club	
1	Dr. P. P. Sharma (Coordinator)	• SSIP ને લગતા સેમિનાર અને વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવું અને આયોજિત થયેલ તમામ કાર્યક્રમોનો અહેવાલ સમયાંતરે રજૂ કરવો.
2	Shri M. B. Maradiya (Co- Coordinator)	• SSIP માટે અનુદાન પ્રાપ્ત થાય તે માટેની કામગીરી કરવી.
3	Shri S. P. Raval	• Innovation Club ને લગતા સેમિનાર અને વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવું અને આયોજિત થયેલ તમામ કાર્યક્રમોનો અહેવાલ સમયાંતરે રજૂ કરવો.

30	Right To Information (RTI)	
1	Shri S. P. Parmar	મદદનીશ માહિતી અધિકારી
2	Shri S. A. Khaneja	જાહેર માહિતી અધિકારી
3	Dr. Y. T. Yadav	અપીલ અધિકારી

31	Alumni Association and Parents Association	
1	Shri I. M. Rathod (Coordinator)	• સેમિનાર અને વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવું અને આયોજિત થયેલ તમામ કાર્યક્રમોનો અહેવાલ સમયાંતરે રજૂ કરવો.
2	Shri S. D. Maheria	
3	Dr. V. H. Raval	
4	Dr. V. B. Manek	
5	Shri S. A. Khaneja	• અનુદાન પ્રાપ્ત થાય તે માટેની કામગીરી કરવી અને પ્રાપ્ત અનુદાનનો નિયમોનુસાર વપરાશ કરવો.

1. કોલેજની વિવિધ સમિતીઓએ સમિતીના કાર્યક્રમોનું આયોજન કરવું તથા આ આયોજન આચાર્યશ્રી પાસે મંજૂર કરાવવું.
2. આયોજન મુજબ એડવાન્સ રકમની જરૂરીયાત હોય તો કાર્યક્રમ ઉદ્દિવસ પહેલા લેખિત અરજી આપી એડવાન્સ મેળવી લેવું. જો ભાવપત્રકો મંગાવવાના થતા હોય તો તેને આનુષંધિક પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં કરવી.
3. કાર્યક્રમ પૂર્ણ થયાના સાત દિવસની અંદર અસલ વાઉચરો સાથેનો હિસાબ બે નકલમાં કાર્યાલય ખાતે બિનયૂક જમા કરાવવો.
4. કાર્યક્રમનો રંગીન ફોટોગ્રાફ સહિતનો અહેવાલ ટાઇપ કરાવીને આચાર્યશ્રીને કાર્યક્રમ પૂર્ણ થયાના એક કે બે દિવસમાં રજુ કરવો.

5. કાર્યક્રમની માહિતી, વિદ્યાર્થીઓની યાદી તથા અન્ય બાબતોનું વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કરવું. કમિટીના તમામ સભ્યોએ સરળી ભાગીદારીથી કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવું. વિદ્યાર્થીઓને આપવાની થતી સુચનાઓની નોટીસની ફાઈલ નિભાવવી.
6. વેબસાઇટ માટે જરૂરી માહિતી આપવા માટે કાર્યવાહી હથ ધરવી. તથા સોશયલ મીડિયા જેવા કે, ફેસબુક, ટ્લીટર, LinkedIn, Instagram વગેરે માધ્યમથી વિદ્યાર્થીલક્ષી માહિતી અને કોલેજની શ્રેષ્ઠ બાબતો વિદ્યાર્થી અને સમાજના બહોળા વર્ગ સુધી પહોંચે તે માટેની કામગીરી કરવી.
7. કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં ફોટોગ્રાફિસનું કાર્યાલય ખાતે ડેટાબેઝ ઉલો થાય તે મુજબ તમામ કાર્યક્રમોનો ફોટોગ્રાફિસ શ્રી વિપુલ પાંડોરને જમા કરાવવા.

F.Y.B.Com. Semester 1 and 2		S.Y. B.Com. Semester 3 and 4	
1	Shri I. M. Rathod (Coordinator)	1	Dr. B. N. Solanki (Coordinator)
2	Dr. P.P. Sharma	2	Shri M. J. Mansuri
3	Shri V. P. Gallani		
4	Shri M.B. Maradiya		
5	Shri N. J. Shah		
6	All Teaching Staff		

T.Y.B.Com. Semester 5 and 6		M.Com. Semester 1 to 4	
1	Dr. P. Singh (Coordinator)	1	Shri S.D.Maheria (Coordinator)
2	Dr. V. H. Raval	2	Dr. T. P. Gandhi

Mentor and Mentee:

Sr. No.	Class and Division	Mentor
1	FYBCOM A Division Gujarati Medium	Shri I. M. Rathod
2	FYBCOM B Division Gujarati Medium	Shri M.B. Maradiya
3	FYBCOM C Division English Medium	Shri V. P. Gallani
4	FYBCOM D Division English Medium	Dr. P.P. Sharma
5	SYBCOM A Division Gujarati Medium	Dr. B. N. Solanki
6	SYBCOM B Division Gujarati Medium	Dr. M.J. Mansuri
7	SYBCOM C Division English Medium	Shri N. J. Shah
8	SYBCOM D Division English Medium	Dr. P. Singh
9	TYBCOM A Division Gujarati Medium	Dr. Palak Shah
10	TYBCOM B Division Gujarati Medium	Dr. V. H. Raval
11	TYBCOM C Division English Medium	Dr. V. B. Manek
12	TYBCOM D Division English Medium	Dr. P. Singh

Sr. No.	Class and Division	Mentor
1	M COM Semester 1 & 2	Shri S. D. Maheria
2	M COM Semester 3 & 4	Dr. T. P. Gandhi

સમિતિના કાર્યો:-

1. ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત સરકારશીના પ્રવર્તમાન નિયમોને આધીન રહી કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. આ માટે સમિતી સભ્યોએ નિયત આયોજન કરીને વિદ્યાર્થીશાખાને જાણ કરવી અને સમગ્ર સમિતીના સભ્યો આ પ્રવેશ ફોર્મની ચકાસણીમાં હાજર રહેવું. એનરોલમેન્ટ ફોર્મ ભરવાની કામગીરી વિદ્યાર્થી શાખા સાથે સંકલન કરીને ચોકસાઈપૂર્વક કરવી.
2. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ફોર્મ ભરવાની કામગીરીનું આયોજન કરવું અને પરીક્ષા ફોર્મની ચકાસણી કરવી. વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મમાં કોઈપણ વિગતમાં બુલ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવી.
3. કોલેજની આંતરિક પરીક્ષાના ગુણ ચકાસણી કરવી અને ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ગુણાંકન મોકલવાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવી.
4. વિદ્યાર્થી શાખા દ્વારા તમામ પ્રકારની ફી કલેક્શનની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીનું વિદ્યાર્થી શાખા અને હિસાબી શાખા સાથે રહીને સંકલન કરવાનું રહેશે.
5. વિદ્યાર્થીના પ્રવેશ ફોર્મ, આંતરિક ગુણાંકન અને પરીક્ષા ફોર્મની ચકાસણી વખતે સમિતીના તમામ સભ્યોએ હાજર રહી આ કામગીરી ચોકસાઈપૂર્વક કરવાની રહેશે. આ અંગે ક્ષતિન રહેતેની તકેદારી રાખવી. આ અંગેની જવાબદારી સમિતીની રહેશે.
6. વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ, આંતરિક ગુણાંકન અને પરીક્ષા ફોર્મ તથા આઇ-કાર્ડ માટેની કોમ્પ્યુટર ડેટા એન્ડ્રીની કામગીરી વિદ્યાર્થીશાખા સાથે રહીને સંકલન કરવાનું રહેશે.
7. વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ, રજીસ્ટ્રેશન ફોર્મ અને પરીક્ષા ફોર્મ તથા આંતરિક ગુણાંકન ગુજરાત યુનિવર્સિટી ખાતે સમયસર જમા થાય તેની તકેદારી વિદ્યાર્થીશાખા સાથે સંકલન કરીને કરવી. કોઈ પણ વિદ્યાર્થીનું ફોર્મ કે ગુણાંકન યુનિવર્સિટી ખાતે મોકલવાનું રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી.
8. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની કામગીરી કરવી.
9. ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત સરકારશીના પ્રવર્તમાન નિયમોને આધીન રહી કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અને પરીક્ષા ફોર્મની કામગીરી જે તે વિષયના વિભાગ દ્વારા કરવામાં આવશે. સમિતિ કો-ઓર્ડિનેટરની જવાબદારી રહેશે.

વિદ્યાર્થી શાખાના કાર્યો:-

1. સમિતીના સભ્યો સાથે સંકલન કરી પ્રવેશ અને પરીક્ષા ફી કલેક્શનનું આયોજન કરવું.
2. ગુજરાત સરકારશી તથા ગુજરાત યુનિવર્સિટીના નિયમો અનુસાર ફી કલેક્શનની કામગીરી કરવી તથા ફી સ્વીકાર્ય બદલની પાકી પહોંચ સહી કરીને વિદ્યાર્થીને આપવી.
3. વિદ્યાર્થીના ફી કલેક્શનનું રજીસ્ટરમાં જે તે દિવસની ફી કલેક્શનની વિગતો નોંધી ફી ના નાણાં જે તે દિવસે જ હિસાબી શાખાને જમા કરાવવા. વિદ્યાર્થીના ફોર્મ અને ફી નો હિસાબની ચકાસણી તે જ દિવસે ફીની રસીદબુક સાથે કરી લેવી. હિસાબી શાખાએ તમામ ફી સમયસર સરકારી રાહે સરકારશીના જમા કરાવવાની રહેશે અને આ અંગેની તમામ જવાબદાર હિસાબી શાખાની રહેશે.
4. વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ, આંતરિક ગુણાંકન અને પરીક્ષા ફોર્મ તથા આઇ-કાર્ડ માટેની કોમ્પ્યુટર ડેટા એન્ડ્રીની કામગીરી વિદ્યાર્થી શાખાએ સમિતીના સભ્યો સાથે રહીને સંકલન કરી આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

5. વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ, રજુસ્ટ્રેશન ફોર્મ અને પરીક્ષા ફોર્મ તથા આંતરિક ગુણાંકન ગુજરાત યુનિવર્સિટી ખાતે સમયસર જમા કરવાની કામગીરી તકેદારીપૂર્વક સમિતીના સભ્યો સાથે સંકલન કરી આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. કોઈપણ વિદ્યાર્થીનું એનરોલમેન્ટ, રજુસ્ટ્રેશન કે પરીક્ષા ફોર્મ યુનિવર્સિટી ખાતે મોકલવાનું રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી આ અંગેની તમામ જવાબદારી વિદ્યાર્થી શાખાની રહેશે.
6. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની કામગીરી કરવી.
7. વિદ્યાર્થી શાખાએ વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ છપાવવાની તથા યુનિવર્સિટી ખાતેથી પરીક્ષા ફોર્મ જરૂરી સંખ્યામાં ખરીદીને મેળવવાની તથા તે નિયત કિમંતે વિતરણ કરવાની કામગીરી કરવી તથા આ નાણાં હિસાબી શાખાને જમા કરાવવાના રહેશે. આ અંગેના હિસાબનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ કામગીરીનું સમિતીના સભ્યોએ સંકલન કરવાનું રહેશે.
8. વિદ્યાર્થીઓની જે-તે સેમેસ્ટરની માર્કશીટ યુનિવર્સિટીથી આવ્યેથી, તરત જ વિદ્યાર્થીને પ્રાપ્ત થાય તે અંગેની નોટિસ તૈયાર કરવી અને વિદ્યાર્થીની અસલ હોલટિકિટ લઇને જે-તે વિદ્યાર્થીને જ માર્કશીટ આપવી. આ અંગેનો રજીસ્ટર નિભાવવું. જો વિદ્યાર્થી પાસે અસલ હોલટિકિટ ન હોય તો, વિદ્યાર્થીની ઓળખને લગતા આનુષંખીકપુરાવા મેળવીને રજિસ્ટ્રારશ્રી/આચાર્યશ્રી પાસેથી અનુમતિ મેળવીને માર્કશીટ આપવી. કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થી સિવાય અન્ય કોઇને પણ જે-તે વિદ્યાર્થીની ઓરિજિનલ માર્કશીટ આપવી નહિં.
9. વિદ્યાર્થીઓના Transcript ચકાસણીની ટી.સી., બોનાફિડ, કુપ્લિકેટ આઇ-કાર્ડ, કુપ્લિકેટ રસીદ તથા એન.ઓ.સી. પ્રમાણપત્ર આપવાની કામગીરી કરવાની રહેશે. આ અંગેની તમામ બાબતોનું અદ્યતન રજીસ્ટર નિભાવવાનું રહેશે.



(ડૉ. યોગેશ વાદ્ય)

આચાર્ય

શ્રી કે.કા.શાસ્કી સરકારી વાણીજ્ય કોલેજ
મહિનગાર, અમદાવાદ.

પ્રતિ:-

- સંબંધિત અધ્યાપકશ્રી, સદર કોલેજ
- વિદ્યાર્થી શાખા, સદર કોલેજ
- મહેકમ ફાઈલે